



DCL-16080001060401

Seat No. _____

B. Com. (Sem. VI) Examination

July - 2022

Auditing and Corporate Governance - 2

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : દરેક પ્રશ્નની જમણી બાજુ ગુણ દર્શાવેલ છે.

૧ મૂલ્યાંકન અને ચકાસણી એટલે શું ? મૂલ્યાંકનના હેતુઓ અને મહત્વ જણાવો. ૨૦

અથવા

૧ મિલકતોની ચકાસણી કરતી વખતે ઓડીટરે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. ૨૦
તમે આખર સ્ટોક અને અદૃશ્ય મિલકતોનું મૂલ્યાંકન કેવી રીતે કરશો ?

૨ વહેંચણીપાત્ર નફો એટલે શું ? વહેંચણીપાત્ર નફાને અસર કરતાં પરિબળો જણાવો અને વહેંચણીપાત્ર નફા અંગે ઓડીટરની ફરજોની ચર્ચા કરો. ૨૦

અથવા

૨ ડિવિડન્ડ એટલે શું ? ડિવિડન્ડના પ્રકારો અને ડિવિડન્ડ અંગે ઓડીટરની ફરજો જણાવો. ૨૦

૩ ઓડીટરનો અહેવાલ એટલે શું ? ઓડીટ અહેવાલના પ્રકારોની ચર્ચા કરો. ૧૫

અથવા

૩ ઓડીટ સર્ટિફિકેટ અને ઓડીટરની જવાબદારી પર વિસ્તૃત નોંધ લખો. ૧૫

૪ ટૂંક નોંધ લખો : (કોઈ પણ ત્રણ) ૧૫

(૧) કોર્પોરેટ ગવર્નન્સ

(૨) રેટિંગ એજન્સી

(૩) ગ્રીન ગવર્નન્સ

(૪) નીતિશાસ્ત્ર સમિતિ

(૫) નૈતિકતા અને નીતિશાસ્ત્ર.

ENGLISH VERSION

Instruction : Figures to the right side indicate marks.

- 1 What is valuation and verification ? State objectives and importance of valuation. **20**

OR

- 1 State the points to be kept in mind by the auditor while verification of assets. How will you make valuation of closing stock and intangible assets ? **20**

- 2 What is divisible profit ? State factors affecting to divisible profit and discuss auditor's duties towards divisible profit. **20**

OR

- 2 What is dividend ? State types of dividend and auditor's duties towards dividend. **20**

- 3 What is auditor's report ? Discuss types of audit report. **15**

OR

- 3 Write detail note on audit certificate and auditor's liability. **15**

- 4 Write short notes : (any three) **15**

- (1) Corporate Governance
- (2) Rating Agency
- (3) Green Governance
- (4) Ethics Committee
- (5) Morality and Ethics.